



Corporate Office: 15,16 & 17, Maker Chambers-III, 1st Floor, Jamnalal Bajaj Road, Nariman Point, Mumbai 400 021 Tel.: 91 22 4353 0400 • E-mail: bluechiptex@gmail.com • Website: bluechiptexindustrieslimited.com

CIN: L17100DN1985PLC005561

Date: 12th May, 2022

To,
Dept. of Corporate Services (CRD)
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001.

Scrip Code: 506981

<u>Sub.: Submission of Newspaper Advertisement issued pursuant to the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016.</u>

Dear Sir / Madam,

Pursuant to Regulation 30 read with Part A of Schedule III of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith copies of newspaper advertisement published in Business Standard (English) and Western Times (Gujarati) on 12th May, 2022, pertaining to the notice published pursuant to the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time (the Rules), for the information of the equity shareholders of the Company whose shares are due for transfer to the Demat Account of Investor Education and Protection Fund Authority under the said Rules.

Further, the aforesaid information is also available on the website of the Company at www.bluechiptexindustrieslimited.com.

Kindly take the above on your record and disseminate the same for information of investors.

Thanking You,

Yours faithfully,

For Blue Chip Tex Industries Limited

Bhumit .M. Dharod

Bhurit . M. I

Company Secretary & Compliance Officer

Membership No.: ACS 51555

Encl: as above

PUBLIC NOTICE

This is to inform the general public that Original Share Certificate no. 27 distinctive nos, from 131 to 135 for Mr. Satish Gunwantrao Chaudhari Architects & Technicians Co-operative Housing Soc. Ltd., having address Plot no. 341, Madhusudan Kalelkar Marg, Ward H-East, Taluka Andheri city, Bandra East, Mumbai 400051 have been lost/misplaced. The above member of the Society have applied for duplicate shares The Society certificate. hereby invites claims and objections from any claimants or objectors for issuance of duplicate within a period 15 (Fifteen) days from the publication of this notice. If no claims / objections are received within the period prescribed above, the Society shall be free to issue duplicate Share Certificate in such manner as is provided under the bye-laws of the Society.

For and on behalf of **Architects & Technicians** Co-operative Housing Society Ltd. Sd/

Chairman Date: 12/5/2022 Place: Mumbai

PUBLIC NOTICE

This is to be informed to public at large that my clients (1) MR.AVINASH
KUMAR SONDHI & (2) MRS.PINKY SONDHI have sold Flat no.801 Diamond Isle II Chs Ltd ,Royal Palms Goregaon East, Mumbai 400065 to MISS PRIYA VEDPRAKASH PANDEY having registered sale agreement at Jt. Sub Registrar Borivali 1 vide Document no. BRL1-2142-2022 on 14.2.22.The 2 origina parent documents of the above property 1) BRL3-6474-2014 & 2) BDR2-03381-2011 are found misplaced and complaint has been recorded at Kotwali-Hrishikesh police station Dehradun on 3rd May 2022 I anybody have any objection/claim regarding the above sale kindly send your claim/objection within 15 days from the date of publication of this notice failing which no claim will be entertained and the sale will be considered valid. Thanking you, Yours truly

Sd/

Advocat/e SYED AMANULLA ADVOCATE HIGH COURT Office : Q Block,R.No 86, Jhulamaidan Road **Near Rafiq Cycle** Jogeshwari East, Mumbai 400060

mentioned in the Notice dated 11th May, 2022

information purpose only.

days inclusive)

S. No.

1

TENDER NOTICE

PRABHA ENERGY PRIVATE LIMITED 12A Abhishree Corporate Park, Opp. Swagat Bunglow BRTS Bus Stop,

	bopai Ambii Road, Ambii, Amedabad-300036, Gujarat, Ter No. 1 491 2717 290310				
1	Tender no.	PEPL/CBM/HDPE PIPE/01/05-2022			
	Description of Work	PROCURMENT OF HDPE PIPE AND FITTINGS for CBN Block NK-CBM-2001/1. JHARAKHAND STATE			
	Last date of submission of bid	25th May, 2022 (IST 17:00)			
2	Tender no.	PEPL/CBM/CASING_TUBING/5/2022			
	Description of Work	PROCURMENT OF CASING & TUBING 9-5/8", 5-1/2" AND Tubing 2-7/8"			
	Last date of submission of bid	25th May, 2022 (IST 17:00).			

PEPL, as joint operator, on behalf of consortium comprising with PEPL, ONGCL and IOCL, invites tender from reputed and experienced Indian and International Manufacturer Supplier for procurement of Casing, Tubing & Pup Joint and HDPE Pipes & Fittings. fo North Karanpura CBM Block, Jharkhand, India.

Interested agency may please visit https://pepl.etenders.in. Tender Document is available fo download on our e tender portal at https://pepl.etenders.in

E Mail IDs - raiesh.gupta@prabhaenergv.com

Form No. 3

[See Regulation-15)1)(a)/16(3)]

DEBTS RECOVERY TRIBUNAL, MUMBAI (DRT 3)

hone Exchange Building, Sector 30-A. Vashi Marit 1st Floor, MTNL Telephone Exchange Building, Sector 30-A, Vashi, Navi Mumbai-400 703.

Case No.: OA/699/2021

Summons under sub-section (4) of section 19 of the Act, read with sub-rule (2A) of rule 5 of the Debts Recovery Tribunal (Procedure) Rules, 1993

Exh. No. 10 BANK OF BARODA

VS M/S. SHREEJI ROADLINES 2) MANOJ S HEDA, 291 CHANDMAL KARWA COMPOUND, BHIWANDI, THANE,

) MRS PUSHPADEVI HEDA, 291 CHANDMAL KARWA COMPOUND, BHIWANDI, THANE 1AHARASHTRA - 421 302. **4) MRS MADHURI MANOJ HEDA,** 291 CHANDMAL KARWA COMPOUND, BHIWANDI,

HANE, MAHARASHTRA - 421 302. **5) SURAJ NARAYAN TATLA,** 663 CHANDMAL KARWA COMPOUND, BHIWANDI, HANE, MAHARASHTRA - 421302

SUMMONS WHEREAS. OA/699/2021 was listed before Hon'ble Presiding Officer/Registrar on **12/05/2021**. WHEREAS, this Hon'ble Tribunal is pleased to issue summons / notice on the said Applicatio under section 19(4) of the Act, (OA) filed against you for recovery of debts of Rs. 2704421.40 (application along with copies of documents etc. annexed). In accordance with sub-section (4) of section 19 of the Act, you, the defendants are directed a

i) to show cause within thirty days of the service of summons as to why relief prayed for should of be granted; i) to disclose particulars of properties or assets other than properties and assets specified by th pplicant under serial number 3A of the original application;

applicant under serial number 3A of the original application; (iii) you are restrained from dealing with or disposing of secured assets or such other assets and properties disclosed under serial number 3A of the original application, pending hearing and disposal of the application for attachment of properties; (iv) you shall not transfer by way of sale, lease or otherwise, except in the ordinary course of his business any of the assets over which security interest is created and/or other assets and properties specified or disclosed under serial number 3A of the original application without the properties specified. rior approval of the Tribunal: nor approvator the infounar, y) you shall be liable to account for the sale proceeds realised by sale of secured assets or othe ssets and properties in the ordinary course of business and deposit such sale proceeds in th ccount maintained with the bank or financial institutions holding security interest over suc

assets. You are also directed to file the written statement with a copy thereof furnished to the applicar and to appear before Registrar on 07/06/2022 at 10:30 A.M. failing which the application shall b heard and decided in your absence.

Given under my hand and the seal of this Tribunal on this date: 7/12/2021.

Note: Strike out whichever is not applicable.



INFOBEANS TECHNOLOGIES LIMITED

CIN - L72200MP2011PLC025622

Registered Office -Crystal IT Park, STP-I 2nd Floor, Ring Road, Indore (M.P.)

Website: www.infobeans.com, Email: investor.relations@infobeans.com, Contact No.: 0731 - 7162000, 2102

NOTICE OF POSTAL BALLOT

Pursuant to section 110 of the Companies Act, 2013 read with rule 22 of the Companies

(Management and Administration) Rules 2014)

Members are hereby informed that pursuant to Section 110 read with rule 22 of the Companies (Management & Administration) Rules

2014 and other applicable provisions if any and, Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and

Disclosure Requirements) Regulations, 2015 (including any statutory modification or re-enactment thereof for the time being in force)

and pursuant to other applicable laws and regulations, completed the e-mail of the Postal Ballot Notice through Share Transfer Agent

RTA). Link Intime India Pvt. Ltd., for seeking their approval by way of ordinary/special resolutions in respect of the businesses

Each Member's voting rights shall be in proportion to his/her share of the Paid up Equity Share Capital of the company as on cut off date

i.e06th May, 2022 which only be considered for voting. A person who is not a Member as on the cut-off date should treat this notice for

The company has engaged service of Link Intime India Pvt Itd for providing Remote E-voting to its Members. The Remote e-voting

facility will commence on Thursday, May12, 2021 at 09:00 a.m (IST) and will end on Friday, June 10, 2022 at 05:00 p.m.(IST) (both

Mr. Manish Maheshwari, Practicing Company Secretary has been appointed as the Scrutinizer at the meeting of the Board of Directors

The Scrutinizer will submit his report, after the completion of scrutiny, to Mr. AvinashSethi. Co-founder of the Company or any person authorized by him. The result will be announced by any Director of the company duly authorized on 11th June, 2022 and will also be

displayed on the website of the company (www.infobeans.com), besides being communicated to the Stock Exchanges, Depositories

The remote e-voting period will commence on 12th May, 2022(9:00 hours IST) and will end on 10th June, 2022 (17:00 hours IST).

During this period, Members of the Company holding shares either in physical form or in demat form, as on the cut-off date i.e. Friday,

May 06, 2022 may cast their vote electronically. The e-voting module shall be disabled by NSDL for voting thereafter and the voting

The Notice along with Postal ballot Form has also been placed on the website: www.infobeans.com of the Company, on the website of

Details of the person for addressing the grievance connected with the facility for voting by electronic means: Ms. Surbhi Jain, Company

Secretary and Compliance Officer, Crystal IT Park, STP-I, 2nd Floor, Ring Road, Indore(M.P.), Phone no. 0731 7162102 or email at

of the Company, who in the opinion of the Board can conduct the remote e-voting process in fair & transparent manne

National Stock Exchange www.nseindia.com and on Link Intime e-voting system link https://instavote.linkintime.co.in

Signature of the Officer Authorised to issue summor (SANJAI JAISWAI

InfoBeans

Resolution required (Ordinary/Special)

Special Resolution

Special Resolution

By order of the Board

Surbhi Jain

For InfoBeans Technologies Limited

Company Secretary and Compliance Officer

Whereas :

CLARIANT

District Deputy Registrar, Co-operative Societies, Mumbai (1) City

Malhotra House, 6th Floor, Opp. G. P. O., Fort, Mumbai- 400 00

FOR DEEMED CONVEYANCE OF

Simplex Building Co.op.Housing So.Ltd., Simplex Building, Ground Floor, 38/40, Pavwala Street, Mumbai- 400 004.

a) Shri. Ambarish Kapadia, Prospect Chambers, 2nd Floor, D. N. Road,

D. N. Koad, Numbai- 400 001.

4. Shri, Narotam Devidas,
Prospect Chamber, 2nd Floor,
D. N. Road, Mumbai- 400 001

5. Shri, Solomon N. Chinoy,
Chinoy Mansion, August Kranti Marg,
Near Warden Road Church, Mumbai- 400 036.

Mumbai- 400001 (legal heir of Lakshmidas Devidas

All the concerned persons take notice Simplex

Building Co. op. Housing So.Ltd., Simplex Building, Ground Floor, 38/40, Pavwala Street, Mumbai-400 004 has applied to this office on date 25.01.2022 for declaration of Deemed conveyance (The Maharashtra Ownership Flats Regulation of the Promotion of Construction, Sale, Management and Transfer) Act, 1963) of the properties mentioned below.

Hearing of said application was kept on dt. 03.03.2022, 14.03.2022, 29.03.2022, 11.04.2022, 26.04.2022 & dt. 09.05.2022 and for said hearing opponents 2 to 5 were not present. Therefore on principles of natural justice hearing of above mentioned case is fixed on dt. 02.06.2022 at 3.00 pm., to hear

opponents parties as a last chance. Failure to remain

present by non applicant will result in expartee hearing of application.

DESCRIPTION OF THE PROPERTY

Place of land situated at

Place of land situated at Cadastral Survey No. 1153, Girgaon Division, Pavwala Street, Mumbai- 400 004 Mumbai City admeasuring 1076.55 square meters or thereabouts together with the building standing / constructed requested for conveyance by the Applicant society.

Those who have interest in said property may submit their say in writing with evidence within 15 days from the date of publication of this notice and may remain present for hearing at the office mentioned above. Failure to submit any say shall be presumed that nobody has any objection and further action will be taken.

(J. D. PATIL)

Competent Authority and

District Deputy Registrar, Co-operative Societies, Mumbai (1) City

Place:- Mumbai No. DDR1/MUM/ Notice/341/2022 Date:- 10/05/2022

Versus Shri. Laxmidas Devidas (deceased)

Shri. Mathurdas Devidas Shri. Haridas Devidas

Prospect chamber, last floor, D. N. Road, Mumbai- 400 001.

Application No. 06/2022

.....Applican

Clariant Chemicals (India) Limited CIN: L24110MH1956PLC010806 Regd. Office: Reliable Tech Park, Gut No. 31, Village Elthan

Off Thane-Belapur Road, Airoli, Navi Mumbai - 400708 Phone: (+91) 22 7125 1000; E-mail: investor.relations_India@clariant.com

Website: www.clariant.com/pigments **POSTAL BALLOT NOTICE**

Members are hereby informed that pursuant to provisions of Section 110 of the Companies Act, 2013, read with the Companies (Management and Administration) Rules, 2014, read with General Circular No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 22/2020 dated June 15, 2020, Circular No. 33/2020 dated September 28 2020, Circular No. 39/2020 dated December 31, 2020, Circular No. 10/2021 dated June 23, 2021, Circular No. 20/2021 dated December 08, 2021 and Circular No. 3/2022 dated May 5, 2022, issued by the Ministry of Corporate Affairs (MCA) (hereinafter referred to as "the MCA Circulars"), Clariant Chemicals (India) Limited ("the Company") has completed the dispatch of Postal Ballot Notice, dated May 10, 2022, on May 11, 2022 by email to all the members of the Company for seeking approval through Postal Ballot / eVoting by way of **Special and Ordinary Resolutions** for the businesses

mentioned in the said Postal Ballot Notice. The Postal Ballot Notice has been sent to all the members, whose names appear on the Register of Members / List of Beneficial Owners, as received from National Securities Depository Limited (NSDL) and Central Depository Services (India) limited (CDSL) as on May 6, 2022.

In view of the ongoing scare of a fresh wave of pandemic of COVID-19, and in accordance with the MCA Circulars, the Company has sent Postal Ballot Notice only by way of email and the communication of assent / dissent of the members will take place only through the remote e-voting system.

The Board of Directors of the Company has appointed Mr. Bhadresh Shah Proprietor of Bhadresh Shah & Associates, Company Secretaries (COP 15957 ACS 23847) as the Scrutinizer for conducting Postal Ballot process in a fair

As required under Regulation 44 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide the facility for voting through electronic mode (E-Voting) through Central Depository Services (India) Limited (CDSL) e-Voting platform. The detailed procedure of E-Voting is given in the Postal Ballot Form.

Members who have not registered their email address, and/or Bank Account letails, are requested to register the same by following the procedur prescribed in the Notice of Postal Ballot.

Details of Voting Schedule:

Sr.No.	Particulars	Schedule
1.	E-Voting	
	Date & Time of commencement of eVoting	May 11, 2022 (09:00 a.m.)
	Date & Time of closure of eVoting	June 10, 2022 (05:00 p.m.)

The eVoting module shall be disabled by CDSL for voting after the closure ime at 05:00 p.m. on June 10, 2022.

For any grievances / queries regarding e-Voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or contact:

Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022-23058542/43.

The Postal Ballot Notice alongwith, Explanatory Statement under Section 102 of the Companies Act, 2013, e-Voting procedure and instructions thereof is available on the Company's website: www.clariant.com, on the website of CDSL: www.cdslindia.com and on the website of BSE Ltd.: www.bseindia.com and National Stock Exchange of India Ltd.: <u>www.nseindia.com</u>

For Clariant Chemicals (India) Limited

Date : May 11, 2022 Amee Joshi Place: Navi-Mumbai **Company Secretary**

PUBLIC NOTICE

Description of Resolution

Company (ies) of the company under ESOP 2022

shall not be allowed beyond the said date and time.

investor relations@infobeans.com

Date: 12.05.2022

Approval of InfoBeans Partnership Program (Employee Stock Option Plan 2022)

Approval of Grant of Options to the Employees/Directors of the Subsidiary

Public at large are hereby informed that my clients Mrs. Sushma Sandip Kasar and 8 others being members of a society known as Vatsalya Society situated at M. D. Keni Marg, Bhandup East, Mumbai - 400 042 and on their behalf I give this Public Notice as under :-

My clients state that they have given their aforesaid property situated on Plot bearing No.7 bearing CTS No.535/7 and assessed by the Municipal Corproation of Greater Mumbai under No.SX01036600860000 for redevelopment purpose under a development agreement dated 07.11.2017 duly registered at the Sub Registrar's Office on 31.10.2017 under No.13303 of 2017 to M/s. Harsh Realtors represented by its owner Mr. Padmakar P. Gokarna and having his office at L/98, The Dreams the Mall, L.B.S. Marg, Bhandup West, Mumbai - 400 078 now having his office at B-309, Magnet Mall (Neptune Mall) L.B.S. Marg, Bhandup West, Mumbai-400 078 (hereinafter called the said developers). My clients state that though the said developers, have agreed to complete the construction of their said property within 2 years and though the said time limit has expired long back, he has not done anything in the matter nor even have obtained any permission from the concerned competent authorities. Therefore, my clients have terminated the said agreement with the above referred developers by their notices dated 03.08.2020, 19.02.2021 and by a final notice dated 16.02.2022. Though the said developers have received the aforesaid termination notices, he has neither replied nor complied with the requisitions thereof.

Date :- 12.05.2022

केनरा बैंक Canara Bank 📣 सिंडिकेट Syndicate

kul, Old Agra Raod, PB No. 414

POSSESSION NOTICE [SECTION 13(4)]

(For Immovable property)

The undersigned being the Authorised Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice Dated **26/11/2021** Which was Delivered to you through Paper Publication in Punya Nagari and Business standard on 02/12/2021 calling upon the borrower / guarantor Borrower / Co Borrower - Mr. Jetendra Shivaji Bhamre and Mrs. Nivedita Anand Pawar to repay the amount mentioned in the notice, being Rs. 2,25,480.33/- (Rupees. Two Lakh Twenty Five Thousand Four Hundred Eighty and Thirty Three Paise only) within 60 days from the date of receipt of the said notice

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 11th day of May of the year 2022.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the Assets. Any dealings with the property will be subject to the charge of Canara Bank for an amount of Rs. 2,25,480.33/- and interest and cost thereon

The borrower's attention is invited to the provisions of Section 13(8) of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Properties

Flat No. 10, Matsgandha Co-op HSg. Soc., Stilt Floor admeasuring 50.78 sq. Mtrs., situated at S. No. 719/1+ 720/47 of Village Nashik, Taluka and Dist. Nashik.

Place: Nashik Road Branch



Authorised Officer, Canara Bank

FORM NO. URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI [Pursuant to section 374(b) of the companies Act 2013 and rule 4(1) of the companies (Authorised

2013 and rule 4(1) of the companies (Authorised to Register) Rules, 2014]

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is proposed to be made after fifteen days hereof but before expiry of thirty days hereinafter to the Registrar at Mumbai that Madhuson Exports a partnership firm may be registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder Part I of Explicit made after the registered upder the r firm may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company

. The principal objects of the company are as

To carry on business of Import, Export, processing, packing, re-packing, trading in, purchase, sell and to act as mercantile agents, learing and forwarding agents, brokers onsignors, consignees, conversion agents istributors, act as stockiest or otherwise in any ther manner deal in all types of food and food roducts, organic foods, processed foods, acked foods, frozen foods, canned and Jarred oods, poultry products, groceries including all ypes of cereals, pulses, edibles, all types of regetables, and fruits, dry fruits, jam, pickles, nasalas, masala mixes, coffee and coffee indisals, masala milkes, other and cone products, tea & Tea products, edible oils, products, condensed milk, flavored milk, ice cream, butter, baked products, confectioneries, weets, preservatives, food supplements, nutrients, natural or synthetic chemicals used or processing and preservation in the food

B. A copy of the draft memorandum and articles in Acopy of the proposed company may be frassociation of the proposed company may be nspected at the office at 402, A Wing, Shrikant Chembers, V. N. Purav Marg, Chembur, Mumbai - 400 071.

MUMDa1-40U0/1.

A. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Center (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6,7,8, Sector 5, IMT Manesar, District Gurgaon (Haryana), Pin Code-122050, within twenty one days from the date of publication of this notice. days from the date of publication of this notice vith a copy to the company at its registere Name(s) of the Applicants

1. Soni Agarwal 2. Taru Agarwal 3. Sonakshi Agarwal 4. Komal Krishna Bhojraj

5. Rekha Agarwal 6. Gaurav Wadhawan

. Gauray wagnawan . Gurpur Ramdas Kamath . Rajesh Devendra Upadhyaye Dated this 12th day of May 2022

BLUE CHIP TEX INDUSTRIES LIMITED

CIN: L17100DN1985PLC005561 Registered Office: Plot No. 63-B, Danudyog Sahakari Sangh Ltd, Village Piparia, Silvassa UT of Dadra & Nagar Haveli- 396 230 Email Id: bluechiptex@gmail.com, Website: www.bluechiptexindustrieslimited.com, Tel. No.: + 91 22 4353 0400

NOTICE

Transfer of Equity Shares to Demat Account of the Investor Education and Protection Fund (IEPF) Authority.

NOTICE is hereby given that pursuant to the provisions of Section 124 (6) of the Companies Act 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit Transfer and Refund) Rules, 2016, as amended from time to time ("the Rules"), equity shares o the Company in respect of which dividend(s) has not been encashed or claimed by the shareholders of Blue Chip Tex Industries Limited ("the Company") for the last consecutive period of seven (7) years or more, are required to be statutorily transferred by the Company to Demat Account of IEPF Authority established by the Central Government. The unclaimed unpaid dividend for last seven (7) consecutive years commencing from the dividend for the inancial Year 2014-15 upto Financial Year 2020-21 of certain shareholders, are presently lying with the Company. The unclaimed / unpaid dividend(s) for the Financial Year 2014-15 will be transferred to IEPF by 21 st September, 2022.

Accordingly and adhering to the various requirements set out in the Rules, individua communications to the concerned shareholders is being sent at their latest available addresses whose shares are required to be transferred to Demat Account of the IEPF Authority as per the aforesaid Rules for taking appropriate action(s). In case the Company does not receive an communication from the concerned shareholders by 21 st August, 2022, the Company shall with a view to complying with the requirements set out in the Rules, transfer the shares to Dema Account of the IEPF Authority by the due date as per the procedure stipulated in the Rules Further, the Company has uploaded full details of such shareholders along with the details of their shares which are due for transfer to Demat Account of IEPF Authority, on its websit www.bluechiptexindustrieslimited.com. Shareholders are requested to refer to the aforesaid vebsite of the Company to verify the details of their un-encashed dividend(s) and shares tha are liable to be transferred to Demat Account of the IEPF Authority.

The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF authorities, may note that the Company would be issuing new share certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose of transfer o shares to IEPF authorities as per Rules and upon such issue, the original share certificate(s which stand registered in their name will stand automatically cancelled and be deemed nor negotiable. The shareholders may further note that the details uploaded by the Company on it vehiste shall be deemed adequate notice in respect of issue of new share certificate(s) by the company for the purpose of transfer of shares to IEPF authorities pursuant to the Rules Any further Dividend on such shares shall be credited to the IEPF and no claim shall lie agains

the Company in respect of the unclaimed / unpaid Dividend and / or the shares transferred to IEPF. On transfer of the Dividend and the shares to IEPF, the shareholders may claim the same by making an application to IEPF in Form IEPF – 5 as per the procedure prescribed in the Rules The said Form is available on the website of IEPF viz. www.iepf.gov.in.

In case the Shareholders have any queries on the subject matter and the Rules, they may contact the Company's Registrar and Transfer Agent ("RTA") or the Company at below nentioned addresses:

Bigshare Services Private Limited (RTA), 1st Floor, Bharat Tin Works Building, Opp Vasant Oasis, Makwana Road, Marol, Andheri East, Mumbai - 400, 059 Email:investor@bigshareonline.com,Tel No:+91 22 6263 8200, Fax No.: +91 22 6263 8299 Blue Chip Tex Industries Limited, Office no 15-17, 1 st floor, Maker Chambers III, Jamnala Nariman Point, Mumbai - 400 021, Email Id: bluechiptex@gmail.com Tel. No. +91 22 4353 0400

> By Order of the Board of Directors For Blue Chip Tex Industries Limite

Place: Mumbai Date: 11th May, 2022

Bhumit .M. Dharod Company Secretary & Compliance Office

Navi Mumbai Municipal Corporation

City Engineer Department
Tender Notice No. NMMC/CE /43/2022-2023 Sr. Tender EMD (Rs.) Work period Name of Work No Cost (Rs.) Development of 2 x 50 TPD Bio-Capital work Gas/Bio-CNG Plant 12 months with Construction, Operation (Including Maintenance for 15 years on monsoon) & Design, Built, Finance, Operate Rs. 3,000/-15 for 01 Rs.22,50,000/and Transfer (DBFOT) Mode for + (18%GST) Operation & Navi Mumbai Municipal = Rs.3,540/maintenance Corporation along with Site Clearance through Scientific Technology at Vashi STP, Navi Mumbai Development and operation of Capital work plant on the principle of "DBOO" 12 months (Design, Build, Own, Operate) of (Including Rs. 3.000/-Public Private Partnership by monsoon) & 02 + (18%GST) Rs.25,00,000/preparing a processing project for 15 for Operation & making Bio-charcoal and = Rs.3,540/briquettes from dry organic waste maintenance at 2 x 50 tons per day at Belapur

Tender booklets will be available on e-tendering computer system at https://nmmc.etenders.in and at www.nmmc.gov.in website of NMMC on dt. 12/05/2022. The tender is to be submitted online at https://nmmc.etenders.in. For any technical difficulties in the e-tendering process, please contact the help desk number given on this website.

The right to accept or reject any tender is reserved by the Hon'ble Commissioner of **Navi Mumbai Municipal Corporation** Sian/-

NMMC/PR Ad no.139/2022

STP, Navi Mumbai.

City Engineer Navi Mumbai Municipal Corporation


BEAT THE HEAT with CR's AC Local Enjoy cool and comfortable journey FARES SLASHED BY 50% (w.e.f. 05.05.2022) Routes CSMT - Thane (34km) ₹95 ₹526 ₹663 CSMT - Kalyan (54km) ₹105 ₹831 ₹1049 **Main Line**

From – To Slow (Dep. Time) Thane-CSMT 8.02 am, 9.03 am, 3.03 pm 5.24 am*,7.04 am, 2.22 pm, 6.57 pm 6.32 am, 8.54 am, 5.27 pm Kalyan-CSMT 7.56 pm, 9.36 pm, 10.56 pm Ambarnath-CSMT 3.12 pm*, 8.50 pm 11.17 am 11.48 am*, 4.55 pm, 7.50 pm Dombivali-CSMT Ambarnath-Dadar 6.30 pm* 12.27 pm, 1.48 pm Badlapur-CSMT Kalyan-Dadar 10.02 am, 11.22 am 11.11 pm Titwala-CSMT 4.47 pm 8.33 am³ CSMT-Kurla 00.31 am 5.20 am, 7.43 am, 8.56 am, 10.04 am, CSMT-Kalyan 8.00 pm, 9.16 pm 4.10 pm, 6.36 pm, 9.42 pm (Semi-Fast 8.04 am, 2.03 pm, 6.10 pm 1.06 pm, 10.20 pm*, 11.12 pm CSMT-Thane Dadar-Thane 00.29 am 11.08 am, 12.30 pm Dadar-Badlapur Dadar-Ambarnath 7.39 pm* 6.30 am' 3.19 pm CSMT-Titwala 9.51 am, 5.00 pm (Semi-Fast)* CSMT-Ambarnath 1.15 pm² 10.22 am*, 3.24 pm, 6.18 pm CSMT-Dombivali Now, enjoy AC services on Sundays and Holidays (w.e.f. 14.05.2022)

From — To Fast (Dep. Time) Slow (Dep. Time Kurla-CSM 6.32 am, 8.54 am Kalyan-CSMT 7.56 pm 4.55 pm Dombivali-CSMT Badlapur-CSMT 1.48 pm Kalyan-Dadar 11.22 am Dadar-Badlapur 12.30 pm CSMT-Kurla 9.56 pm CSMT-Kalyan 5.20 am, 7.43 am, 10.04 am, 6.36 pm CSMT-Dombivali 3.24 pm













ચેજ્ઞાઈસુપર કિંગ્સને આઈપીએલમાં આંચકો લાગશે રવિન્દ્ર જાડેજાને ઈજા થતાં બાકીની મેચો ગુમાવશે



(એજન્સી) નવી દિલ્હી,

ચેજ્ઞાઈના સ્ટાર પ્લેયર અને ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો છે અને તે આઈપીએલની બાકીની મેચો ગુમાવે તેવી શક્ચતા છે. આ પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી દીપક ચહર અને એડમ મિલ્ન પણ ઈજાગ્રસ્ત થઈ ચુકયા છે. રવિન્દ્ર જાડેજા દિલ્હી સામેની મેચમાં નહોતો રમ્યો અને મીડિયા રિપોર્ટ પ્રમાણે બેંગ્લોર સામેની મેચમાં જાડેજાને શરીરના ઉપરના હિસ્સામાં ઈજા થઈ હતી. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે જાડેજા ઈજામાંથી જલ્દી બહાર આવી શકે તેમ નથી ત્યારે શક્ચ છે કે, તે આઈપીએલમાં બાકીની મેચોમાં જોવા ના મળે. રવિન્દ્ર જાડેજા માટે આઈપીએલની વર્તમાન સિઝન એમ પણ બહુ સારી રહી નથી. આ સિઝન શરુ થતા પહેલા તેમને કેપ્ટન બનાવાયા હતા. જોકે પહેલી ચારે મેચ ચેત્રાઈ હારી ગઈ હતી. આઠ મેચ રમાયા બાદ જાડેજાએ કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ધોનીએ ફરી કેપ્ટનશિપ સંભાળી હતી. આ સિઝનમાં જાડેજા ૧૦ મેચમાં ૧૯.૩૩ના એવરેજથી ૧૧૬ જ ૨ન બનાવી શક્યા છે. બોલિંગમાં પણ અત્યાર સુધી તેમના ભાગે પાંચ જ વિકેટ આવી છે અને ફિલ્ડિંગમાં પણ જાડેજાથી કેચ છુટ્યા છે.

જોલવાની અક્ષરકેમ કંપનીમાં ੧८ वर्षीय ङामहारनुं (मेही मोत! (प्रतिनिधि) ભરૂચ,

દહેજના જોલવા ગામે આવેલ કાચને ઓગાળી તેનો પાવડર બનાવવાનું કામ કામ કરતી અક્ષર કેમમાં ગાયત્રી એન્ટરપ્રાઈઝના કોન્ટ્રાકટમાં મૂળ ઝારખંડના વતની ૧૮ વર્ષીય પ્રેમકુમાર ગંઝુ કોન્ટ્રાક્ટ લેબર તરીકે છેલ્લા બે મહીનાથી જોલવા ખાતેની અક્ષર કેમ કંપનીમાં નોકરી કરતો હતો જે નાઈટ ડ્યુટીમાં ગતરોજ ગયો હતો.જ્યાં ગત રાતે ૨.૩૦ની આસપાસ અચાનક પ્રેમકુમાર ચાલુ નોકરીએ જ અચાનક ઢળી પડ્યો હતો અને બેભાન બનતા તેને કંપનીની ગાડીમાં બે થી ત્રણ દવાખાને લઈ જઈ ભરૂચ સિવિલ મૃત હાલતમાં લાવતા હજર તબીબે ૪ વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરી લાસને પી.એમ.રૂમમાં ખસેડી હતી.ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા સમગ્ર ધટનામાં બેદરકારી દાખવી ભીનું સંકેલવાના ભાગરૂપે ધટનાની જાણ દહેજ પોલીસને સવારે ૧૦ કલાકની આસપાસ કરી હતી પણ તે પહેલા એક પણ દવાખાનાના તબીબે પણ પોલીસે જાણ કરી ન હતી. કહેવાય છે કે આ ઘટનામાં મૃતકનો પરિવાર ગરીબ હોય મરણ જનારના સાથીદારોએ તેના મોતનું વળતર કંપની પાસે માંગતા ભારે રકઝક બાદ કંપનીએ વળતર પ્રેમકુમારના વાલીવારસોને ટ્રાન્ફર કરી તેમને લાસનો કબ્જો લેવા ઝારખંડથી ભરૂચ બોલાવ્યા છે.મૃતક પ્રેમકુમારનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પી.એમ કરી વાલીવારસોને સાંપી અંતીમ વિધી કરાશેનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે બહારથી કમાવા આવતા કામદારોને કંપનીમાં લોડીંગનું કામ કોઇ પણ સેફ્ટી વિના કરાવાતું હોવાની બુમો છતાં તંત્ર દ્વારા આવી કંપનીઓ પર કોઇ પગલાં નથી લેવાતા

વચન પાલન અને સત્યપ્રીતિ એ સૌથી મહત્વના ગુણો છે : ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી સત્કર્મ પરિવારના તત્વાવધાનમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ પરિવાર દ્વારા

જેથી આવા આશાસ્પદ યુવાનો કમોતે મોતને ભેટે છે.જો કે હાલમાં પણ પ્રેમકુમારના મોતનું કારણ અકબંધ રહ્યું છે અને મોડે મોડે કંપનીએ પોલીસને જાણ કરતા દહેજ મરીન પોલીસે વધુ તપાસ હાથધરી છે.

વિશ્વભરમાં સત્સંગ થતો રહે, શાસ્ત્રોના સાત્વિક અર્થઘટન દ્વારા લોકોના જીવન સફળ અને સક્ષમ બની રહે તે ઉપક્રમ અંતર્ગત સ્વ. શ્રી શીલાબહેન અને ઈન્દ્રવદનભાઈ મોદીની પૂણ્યસ્મૃતિમાં પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીના શ્રીમુખે સનાતન વૈદિક સંસ્કૃતિના શાસ્ત્રોના આધાર પર સમગ્ર વિશ્વમાં પોતાના ઘરોમાં બેઠેલાં લોકો હકારાત્મક વિચારો ગ્રહણ કરે, જીવનમાં ગુમે તે સમસ્યા આવે પરંતુ તેનાથી વિચલિત થયા વગર તેમાંથી વિજયી બની બહાર આવે અને માત્ર કર્મકાંડાત્મક નહીં પરંતુ પ્રેરણાત્મક અવા આ પ્રવચન માાલકાના ભાગરૂપ આયાાજત વાાલ્મકા રામાયણ પઠનન આગળ ધપાવતા શ્રી પંડ્યાજીએ જણાવ્યું કે વાલ્મિકી રામાયણમાં સાત કાંડ છે, બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, યુદ્ધ અથવા લંકા કાંડ અને ઉત્તરકાંડ. તેમાં ૫૦૦ સર્ગ છે. ૨૪,૦૦૦ શ્લોક છે, જેમાં સમગ્ર રામકથાનું વર્ષન કરાયું છે.

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ નવમી આવૃત્તિ મે ૧૧થી ૧૫ દરમિયાન યોજાશે

બિઝલિટફે સ્ટ

ઉદ્યોગસાહસિકતા, વેપાર અને

ઉદ્યોગ એ ગુજરાતની અભિશ

ઓળખ છે. ફાઉન્ટેનહેડ - અંગ્રેજી

અને હિંદીનાં શ્રેષ્ઠ સાહિત્ય અને

માને છે કે સાહિત્ય એ માત્ર

પુસ્તકોના બે પુંઠા વચ્ચે જ મર્યાદિત

નથી. અમે માનીએ છીએ કે સાહિત્ય

એ વાર્તા કહેનારી દરેક વ્યક્તિમાં

હોય છે, પછી ભલે એ વાર્તા કહેવા

માટેનું તેમનું માધ્યમ કોઈ પણ હોય.

સર્જનાત્મકતાની અભિવ્યક્તિનાં

તમામ સ્વરૂપો અને માધ્યમો જેવાં

કે થિયેટર, ફિલ્મ, પત્રકારત્વ.

બ્લોગિંગ વગેરેની ઉજવણી થાય છે.

"પ્રભુને ગમે" પુસ્તિકાઓ વહેચો

વર્ષગાંઠ,પુણ્યતીથીઓ બેસણામાં વિ

"જ્ઞાનચર્જ્ઞ",સંસારમાં સ્વર્ગીચતા લાવે

ઘરડાઘરો ને છુટાછેડાઓ અટકે

િંદાંપત્યો ને કુંટુંબો ભાવપૂર્ણ બને

સુખી.શુચી,શ્રીમંતો,હજારો લાખોમાં

વહેર્ચે. માતાપિતા.કુળવંશજોના

ફોટાઓ સાથે-૧૬-૨૪ પેજમાં તમારુ

લખાણ મૂકીને, પુસ્તિકાઓ વહેચી

પાછલી પેઢીને, કુળ.કિર્તીની ભવ્યતા

નો ગોરવપૂર્ણ, ઈતિહાસ,આપવો

તે જાગૃત,બુધ્ધીમાનોનું,શ્રેષ્ઠ કર્મ છે

ક્યાં, કેવી રીતે. વહેચવી. ફોન કરો

ભાવો. રૂા. ૫/-૯/-૧૦/-૧૩/-૨૪/-

દાંદાર્થી નથીઃ મો.૮૧૨૮૨૮૬૧૬૧

જીએલએફમાં

જીએલએફ શરૂઆતથી જ

સર્જકોની રજૂઆત થશે

આથી

(પ્રતિનિધિ) અમદાવાદ, ડિઝાઇન કરવામાં આવેલો ફેસ્ટિવલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ છે. (જીએલએફ)ની નવમી આવૃત્તિ અમદાવાદ મેનેજર્મેન્ટ એસોસિએશન ખાતે મે ૧૧થી મે ૧૫ દરમિયાન યોજાશે. જીએલએફ એ ગજરાતના સૌપ્રથમ અને સૌથી લોકપ્રિય તથા સૌથી મોટા સાહિત્યિક કાર્યક્રમ તરીકે જાણીતો છે. જીએલએફ આ અગાઉ અમદાવાદમાં છ વખત અને વડોદરામાં બે વખત યોજાઈ ચુક્યો છે. લગભગ અઢી વર્ષોના સમયગાળા બાદ જીએલએફ યોજાશે. છેલ્લે ડિસેમ્બર ૨૦૧૯માં

ગુજરાતી સાહિત્ય મહોત્સવમાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને લૅગતા કાર્યક્રમો થશે., ઇન્ડિયન સ્ક્રીનરાઇટર્સ ફેસ્ટિવલમાં હિંદી સિનેમાનાં પટકથા લેખકોની ગુજરાતમાં રોચક ઉપસ્થિત રહેશે. આ અનોખા ફેસ્ટિવલનું આયોજન સ્ક્રીનરાઇટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે સંયુક્ત રીતે થઈ રહ્યું છે. ટાબરિયાં - ૪ થી ૧૪ વર્ષના બાળકોનાં ઑડિયન્સ માટે ખાસ

જીએલએફનું આયોજન થ્યું હતું.

લેસ્ટર્ન ટાઇમ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન

ટ્રેક મશીનોના પીઓએચ માટે વિવિધ સામગ્રીઓની આપૂર્તિ S-ટેન્ડર નોટીસ નં. 04 2022-23. તા.05-05-2022. ટેન્ડર નં. સીઈ/સીપીઓએચ/એડીઆઈ/22– 23–3 (1) કામનું નામઃ વર્ષ 2022-23 માટે સીપીઓએચ અમદાવાદ ખાતે ટ્રેક મશીનોના પીઓએસ્ટ સાપાઆઅગ અમદાવાદ ખાત ટ્રક નશાગાળા પાઝાઝન માટે વિવિધ પ્રકારના બોલ્ટ્સ, નટ્સ અને વૉશર્સન આપૂર્તિ. (2) **એનઆઈટી અંદાજીત કિંમત**ે 18,85,880.00/- (3) ઈએમડીઃ ₹ 37,720.00/- (4) ટેન્ડર બંધ થવાની અને ખુલવાની તારીખ અને સમયઃ તા.06-06-2022 ના 11:00 કલાકે અને તા.06-06-2022 ના 11.15 કલાકે. (5) IREPS પર ટેન્ડર અપલોડ થવાની તારીખ: તા. $0\dot{2} - 05 - 2022$. વેબસાઈટ વિગતઃ https://www.ireps.gov.in અમને ફ્રોલો ક્રોઃ 🔛 twitter.com/WesternRly

જુગાર રમતા ઝડપાયેલા ભાજપનાMLA કેસરીસિંહ સહિત ૨૬ આરોપીઓ દોષિત જાહેર

શિવરોજપુર ખાર્ત જીમીરા રિસોર્ટ માંથી ઝડપાયેલા હાઇ પ્રોફાઇલ જુગાર ધામના ગુનામાં આરોપી બનેલા માતર ભાજપ ના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામેત ૨૬ આરોપીઓ ને સામત રદ આરાપાઆ ન આજરોજ હાલોલ અદાલત ના એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રેમ હંસરાજ સિંહ દ્વારા જુગાર ધારાની કલમો હેઠળ બે વર્ષ સમ્ન કેદની સજા ફટકારતો હુકમ કરતા આરોપી તરીકે હાજર રહેલા માતર ભાજપ ના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના સત્તાના નશાનુ હાસ્ય એકદમ ગાયબ થઇ જવા પામ્યુ હતુ . જોકે ખેડા જિલ્લાના માતર ભાજપ ના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ને હાઈપ્રોફાઈલ જુગારના કેસમાં હાલોલ અદાલત દ્વારા બે વર્ષ સમ્ન કેદની સજા ફટકારી હોવાના ચુકાદાની જાણ સાથે ગુજરાતના સંત્તાધારી ભાજપ સંરકારના રાજકીય મોરચે ગંભીર સજાટો પ્રસરી જવા પામ્યો હતો.!!

(પ્રતિનિધિ) ગોધરા,

હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલા વેભવી જીમીરા રિસોર્ટ માં મહિલાઓની



હાજરીમાં હાઇપ્રોફાઇલ જુગાર રમાઈ રહૃાો હોવાની ચોક્કસ બાતમીના આધારે તારીખ ૧. ૭. ૨૦૨૧ ના રોજ ગોધરા એલ.સી.બી પી.આઈ.ડી.એન .ચૂડાસમા એ જીમીરા રિસોર્ટ ને ધેરો ધાલીને કરેલ રેડ મા ૨૬ આરોપીઓ કે જેમાં સાત મહિલાઓ હતી આ તમામ ને જુગાર રમતા ઝડપી પાડયા હતા એમાં આરોપી તરીકે ૧૮ નંબરના ઝડપાયેલા ચહેરો કોઈ જ સામાન્ય નહીં!! પરંતુ ખેડા જિલ્લાના માતર ના ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી હોવાનું બહાર આવતાં ગુજરાતના રાજકારણમાં ભારે ખેળભળાટ મચી જવા પામ્યો હતો . શવરાજપુર સ્થિત જીમીરા

અમદાવાદ મંડળ પર વર્ષ ૨૦૨૨-૨૩ માટે

મંડળ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિ (DRUCC)ની પ્રથમ બેઠકનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વર્ષ ૨૦૨૨-૨૩ માટે રચાયેલી મંડળ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન વિભાગીય કચેરીના કોન્ફરન્સ હોલમાં કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં સમિતિના સેક્રેટરી અને વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક રવીન્દ્ર શ્રીવાસ્તવે બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને આવકાર્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોતપોતાના વિસ્તારોને લગતી મુસાફરોની સુવિધા વધારવા, રેલવેને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને તેમની વ્યાજબી માંગણીઓ અંગે હકારાત્મક ચર્ચા કરી હતી. સમિતિના અધ્યક્ષ અને મંડળ

રેલ પ્રબંધક તરુણ જૈને તેમને અમદાવાદ મંડળની પ્રવૃત્તિઓ વિશે

અમદાવાદ, માહિતગાર કર્યા હતા. તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી હતી કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ એ અમદાવાદ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં આ સુવિધાઓ મંડળમાં જોવા મળશે.તેમની વ્યાજબી માંગણીઓનું ટૂંક સમયમાં બોર્ડ દ્વારા નિરાકરણ કરવામાં આવશે.અમદાવાદ મંડળમાં ગયા વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ નૂર લોડિંગ થયું છે અને આ સમય દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડબલિંગ ઈલેક્ટ્રિફિકેશન અને ડીએફસી જેવા કામોએ પણ વેગ પકડ્યો. તેમણે આશા વ્યક્ત કરી કે આ કામો પૂર્ણ થયા બાદ અમે અમારા આદરણીય મુસાફરો અને માલવાહક ગ્રાહકોને વધુ સુવિધાઓ

IAR, માં રાજ્યકક્ષાનો અંડર-૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ચોજાચો

પૂરી પાડી શકીશું.



(પ્રતિનિધિ)ગાંધીનગર ગાંધીનગરમાં ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ રિસર્ચ (આઈ એ આર) ધ યુનિવર્સિટી ફોર ઇનોવેશન દ્વારા રાજ્ય કક્ષાનો અંડર-૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારંભ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીડોર જી ના હસ્તે કરવામાં આવ્યો ૧૦મે થી ૧૮મે સુધી ચાલનારી આઠ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્દેશ યુવાનોમાં ખેલદિલીની ભાવના જાગે તેમ આયોજકોએ જણાવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાથી આઇ.એ.આર માં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.

મંત્રી ડોક્ટર કુબેર ડીંડોરએ સંબોધન આપતા કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓએ આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ અને તેમણે રમત ગમત નું જીવનમાં મહત્વ દર્શાવતાં વિદ્યાર્થીઓને

પ્રોત્સાહિત કર્યા હતા કોઈપણ પ્રકારના ખેલનો મૂળભૂત હેતુ વ્યક્તિની ખેલદિલી ને ખીલવી સમાજમાં માતૃભાવના અને ભાઈચારાની સદ્ ભાવના વિકસાવવાનો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારની વિવિધ ખેલકૂદ અને અભ્યાસ લક્ષી યોજનોઓ અને ખેલ મહાકુંભ જેવી પ્રતિયોગિતા ઓનો વધુ ને વધુ લાભ લઇ સાચા અર્થમાં ન્યું ઇન્ડિયાના સ્વપ્રની સાકાર કરવામાં પોતાનો અમુલ્ય ફાળો આપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર ડો. મનીષ પરમાર અને અવિનાશ પટેલ દ્વારા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રોફેસર રાવ ભામિદીમરી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં રાજ્યકક્ષાની વિવિધ ૨૧ જેટલી ટીમો ભાગ લઇ

Franklin Templeton Mutual Fund

Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative

Hotel Grand Pragati, B/h Zydus Hospital, Hebatpur Road, Thaltej - S G Highway, Ahmedabad 380059 Date: 14th May, 2022 Time: 6.30 p.m.

Contact Person: Pravin Sumesara (9898018526) Due to limited seats, entry will be provided to registered attendees only. Please call on the above number to register by tomorrow All Covid protocols will be followed,


> We look forward to your participation. FRANKLIN **TEMPLETON**

Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor. Senapati Bapat Marg, Elphinstone (West) Mumbai - 400013

> Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

AHMEDABAD MUNICIPAL CORPORATION **MAHANAGAR SEVA SADAN**

CENTRAL LABORATORY E-TENDER NOTICE NO.08/2022-23



હાઈ પ્રોફાઈલ જુગારધામના રદ્દ આરોપીઓ


(૧) હર્ષદભાઈ વાલજીભાઈ પટેલ ,(૨) જ્યેશભાઈ ૨મેશભાઈ

આકોલીયા,(૩)પ્રમોદસિંહ વિરેન્દ્રસિંહ ક્ષત્રિય,(૪)જયેશભાઈ લાલજીભાઈ પટેલ (કામાણી), (પ)ગીરીશભાઈ કાશીરામપટેલ, (૬) રાજેન્દ્ર લાલજીભાઈ પટેલ ,(૭) દીપેનભાઈ બાબુભાઈ પટેલ (૮) પ્રફુલ્લેભાઈ રામભાઈ પટેલ , (૯) અનિલભાઈ રમેશભાઈ આકોલીંચા ,(૧૦) નિમેશભાઈ ધીરુભાઈ પટેલ ,(૧૧) મોનાર્ક ગણપતભાઈ પટેલ(ધાનાણી) ,(૧૨) વિકૃમમીસીંગ બસ્નેટ ,(૧૩) શૈલેષભાઈ ધનજીભાઈ માચાણી ,(૧૪) સંજીવભાઈ બળદેવભાઈ પટેલ ,(૧૫)મહેન્દ્રભાઈ મણીભાઈ પટેલ ,(૧૬)જચેશભાઈ રતીભાઈ કાછડીયા ,(૧૭)વિક્રમભાઈ જેઠાભાઈ પરડવા ,(૧૮)કેશરીસિંહ જેસંગભાઈસોલંકી ,(૧૯)પ્રકાશભાઈલાલજીભાઈચોડવડીયા(પટેલ),(२०) रोभाङेहार जरनेट,(२१) मंत्रुजेन नारायण जतीवाडा, (૨૨)હર્ષાબેન દિપેનભાઈ ગોરીયા ,(૨૩)ની જલાલ ઉર્ફેવજુભાઈ દઢાણીચાપટેલ ,(૨૪)મંજુશીવાકોટીચાદવ ,(૨૫)બબીતા ગણેશ પોખરેલ, (૨૬)પીનાબેન હર્ષદભાઈ પટેલ નાઓને જુગાર ધારાની કલમ - ૪ મુજળના સજાને પાત્ર ગુન્હામાં બે વર્ષ ની સખત ફેદની સજા અને દરેક આરોપીઓને રૂ. 3000 / - (લેખે દંડ (એમ તમામ આરોપીઓના ગણતા કુલ રૂા .૭૮૦૦૦ / - ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવે છે. જો આરોપીઓ દંડની રકમભરપાઈ કરવામાં કસૂર કરે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં

રિસોર્ટમાંથી ૨૬ આરોપીઓ સાથે ઝડપાયેલા આ હાઈ પ્રોફાઈલ જુગારધામ ના આ કારનામાર્ઓ સામે પાવાગઢ પી.એસ.આઇ આર.જે.જાડેજાએ તપાસ અહેવાલ અદાલત સમક્ષ રજૂ કર્યો હતો. આ સંદર્ભમાં હાથ ધરાયેલ કાયદાકીય દલીલોની સુનાવણીમાં મદદનીશ સરકારી વકીલ ડી.એન.શર્મા ની

આરોપીઓ વિરુદ્ધ ની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને હાલોલ અદાલાન પ્રાહ્ય રાખાન હાલાલ અદાલતના એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રેમ હંસરાજ સિંહે તમામ ૨૬ આરોપીઓને જુગાર ધારાની કલમૂ ૪ હેઠળ બે વર્ષની સ્ષ્ર કેદની સજા અને પ્રત્યેક આરોપીઓ ને ત્રણ હજાર રૂ! નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

ભારત સાથે તણાવ સર્જનાર ચીનના વડા જ તણાવમાં મગજની બિમારીથી ઝઝૂમતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ



બેઈજિંગ, ભારત સાથે સતત તનાવની

સ્થિતિ સર્જનારા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મગજની એક ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આ બીમારીના કારણે ૨૦૨૧માં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમને સેલેબ્રલ એન્યુરિઝમ નામની મૃગજની બીમારી છે. જોકે ચીનના રાષ્ટ્રપતિને ડોકટરોએ ઓપરેશન કરવાની પણ સલાહ આપી છે પણ જિનપિંગ પારંપરિક ચીની દવાઓથી સારવાર કરવાનુ પસંદ કરી રહ્યા છે. આ પહેલાં પણ જિનપિંગ અસ્વસ્થ હોવાની અટકળો થયેલી હતી.કારણકે

ઓલિમ્પિક યોજાઈ ત્યાં સુધી તેમણે કોઈ વિદેશી નેતા સાથે મુલાકાત કરી નહોતી. માર્ચ ૨૦૧૯માં તેઓ ઈટાલી ગયા ત્યારે પણ દેખાયુ હતુ કે, જિનપિંગને હરવા કરવામાં મુશ્કેલી પડી રહી છે.ફ્રાંસની મુલાકાત દરમિયાન તેમને બેંસવામાં તકલીફ પડી રહી હતી અને એક તબક્કે તેમને ટેકો આપવામાં આવ્યો હતો.

જિનપિંગને સેલેબ્રલ એન્યુરિઝ્મ નામની જે બીમારી છે તેમાં માથાની અંદર એક ધમની પહોળી થતી રહે છે અને તેના કારણે તેની સપાટીને નુકસાન થાય છે. જો તે વધારે પહોળી થાય તો તે તુટી જવાનુ જોખમ રહે છે. આ બીમારીના કાર્ણે દર્દીને કોરોનાની મહામારીની શરુઆત માથાનો દુખાવો, જોવામાં થઈ તે પછી બિજિંગમાં વિન્ટર તકલીફ થતી હોય છે.

કાલોલમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો :વરરાજાના પિતા સહિત ચારને ઈજા

(પ્રતિનિધિ) ગોધરા, કાલોલ મા ગતરાત્રે ડી જે તાલે નીકળેલા વરરાજા ના લગ્નના વરઘોડા પ્રસંગમાં ગધેડી ફળીયા ખાતે બે જૂથ વચ્ચે શરૂ થયેલ બોલાચાલી ની આ દુલીલો અચાનક હિંસક બની જઈને સામસામે પથ્થરમારો અને તોડફોડ શરૂ કરતાં લગ્નનો વરઘોડો એકદમ વેર-વિખેર થઈ ગયો હતો.આ બે જૂથો વચ્ચેની અથડામણમાં વરરાજા જીવ બચાવીને માંડ માંડ માંડવે તો પહોંચ્યા હતા પરંતુ વરરાજાના પિતા સમેત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

કાલોલ ખાતે લગ્ન-પ્રસંગના એક વરઘોડા માં સર્જાયેલા બે કોમ વચ્ચેની જૂથ અથડામણો ની ખબરો ના પગલે પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ડી.વાય.એસ.પી ઓ સમેત સમગ્ર પોલીસ કાફલો કાલોલમાં ખડકાઈ ગયો હતો આ સાથે હાથ ધરવામાં આવેલા કોમ્બિંગ ઓપરેશન માં અંદાજે ૭ થી વધારે ચહેરાઓને રાઉન્ડ અપ કરીને પોલીસ તંત્ર એ મખ્ર તપાસો હાથ ધરી છે

Online Submission:-08/06/2022

www.amc.nprocure.com

Submission Of E.M.D., Tender fee &

Online Documents Date: 09/06/2022

કાલોલ શહેરમાં એક લગ્ન પ્રસંગના વરઘોડામાં તોફાની ટોળાએ પત્થરમારો કરતા રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયોઃ વરરાજાના પિતા સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા કાલોલ શહેરમાં ફરી એકવાર કોમવાદી તત્વો દ્વારા શહેરની શાંતિમાં પલિતો ચાંપવાનો આ પ્રયાસો ની જુથ અથડામણ મા સામ-સામે થયેલી ફરિયાદને આધારે ૭ તોફાનીઓ ને રાઉન્ડ અપ કરાયા છે. કાલોલ મા ગતરાત્રે એક લગ્ન

પ્રસંગ મા ફરતા વરઘોડા દરમ્યાન બોલાચાલી થતાં ટોળાઓએ સામસામે પથ્થરમારો કરતા ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા જે ઘટના દરમ્યાન ફરી એકવાર તોફાને ચઢેલા તો ફાનીઓ એ ગધેડી ફળિયામાં પત્થરમારો કરી આતંક મચાવતા ખાનગી અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડતા બન્ને કોમના ફરિયાદીઓએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ૨૯ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામ-સામે દાખલ થયેલી ફરિયાદની વિગતો મુજબ સોમવારે શહેરના ગધેડી ફળિયામાં રહેતા સચિન રમણભાઈ સોલંકીના

Time: 17.00 pm

Time 17:00 pm

Dy.Muni.Comm.

(North West Zone)



લગ્ન પ્રસંગ નિમિત્તે સાંજે ડી જે સાથે વરઘોડો નીકળ્યો હતો જે વરઘોડો શહેરમાં ફરીને પરત ફરતા સવા અગિયાર વાગ્યાના સુમારે બન્ને ટોળા વચ્ચે બોલાચાલી થતાં બબાલ થઇ હતી અને વરઘોડામાં નાશભાગ મચી જવા પામી હતી. જે બબાલ ગધેડી ફળિયામાં પહોંચતા ગધેડી ફળિયામાં રહેતા ટોળા વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તોફાની ટોળાએ સામસામે પત્થરમારો કરતા ગધેડી ફળિયામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે ઘટના દરમિયાન

તોફાની તત્વોએ અંધારાનો ફાયદો ઉઠાવી ગધેડી ફળિયા અને ભાથીજીમંદિર વિસ્તારમાં ઉભા રાખેલા વાહનો અને લારી ગલ્લાઓમાં ભારે તોડફોડ મચાવી રીતસર આતંક મચાવીને ખાનગી અને જાહેર મિલકતોને ભારે નુકશાન કર્યું હતું. તદ્ઉપરાંત ગધેડી ફળિયામાં પણુ? ભારે તોડફોડ કરતા છકડો ચલાવીને ગુજરાન ચલાવતા એક વિધવા પરિવારના રોજગારીના સાધનો પણ વગર વાંકે તોફાની ટોળાએ તોડી નાખ્યા હતાં.

સિક્ક્યોરિટાઇઝેશન એન્ડ રિકસ્ટ્રકશન ઓફ ફાઇનાપિસએ એફ્સેટ્સએન્ડ એન્ફિસેન્ટ સિક્ક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧ ૩ (૨) હેઠળ (આ કાયદો) સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોસેમેન્ટ) ટ્રલ્સ, ૨૦૦૨ ના નિયમ (આ નિયમો) ૩(૧) સાથે વાંચવામાં આવ્યો છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલ સત્તાઓના ઉપયોગમાં આ નિયમોના નિયમ ૩ ની સાથે વાંચવા, આઈઓ્કએલ ગુદ્ધ કાઇનાન્ય લિમેટડે, (IFL HFL) (અગાઇ ઉન્દેશ ઇન્ફોલ્સઇન હોર્સિંગ કાઇનાન્ય લિમેટડ્રોના અધિકૃત, અધિકૃત્રીએ, બીધ્યુરી ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩ (૨) હેઠળ માંગણી નોટિસ, ઉધાર લેનારા (ઓ) ને, તેઓને સંબંધિત ડિમાન્ડ નોટિસ (ઓ)માં જણાવેલ ૨કમ ારત કરવા માટે હાકલ કરે છે. ઉપરના સંબંધમાં, કરીથી આ સુરના પ્રકાશિત થયાની તારીખથી ೯૦ દિવસની અંદર લેણદાર (ઓ)ને ચૂકવણી હવા માટે સુરના આપવામાં આવે છે, ના વધુ વ્યાજ સાથે, નીચે જણાવેલ રકમ, ઓ માંગણી સુરના યુકવણીની તારીખ સુધી લેણદાર (ઓ) ની વેગત, તારીખ મુજબની રકમ માંગની સૂચના અને લોનની રકમની ચુકવણી માટે આપવામાં આવતી સુરક્ષા નીચે મુજબ છે:

ગત, તારીખ મુજબની રકમ માંગની સૂચના અને લોનની રકમની ચુકવણી માટે આપવામાં આવતી સુરક્ષા નીચે મુજબ છે:					
દેવાદારો/ 1મીનદારોના નામો	ડીમાન્ડ નોટીસ તારીખ અને રકમ	સિક્ચોર્ડ એસેટ (સ્થાઇ મિલ્કત)નું વર્ણન કલેટ નં.૩૦૨. આશરે બિલ્ટઅપ એરીયા ૭૫.૧૮ સ્કે.મી			
ી. ભુમિત પ્રવિણચંદ્ર ઠક્કર, શ્રીમતી. દિપાલી બી. ઠક્કર (Prospect No.732727)	09-05-2022 & Rs.16,04,080/- (રૂપિયા સોળ લાખ ચાર હજાર એંસી ફક્ત)	સુપર બિલ્કઅપ એરીયા ૧૨૫.૪૬ રકે. મી. વિંગ-એ, ત્રીજો ટિકા નં.૧૧૪, સી. એસ. નં.૪૭૧૮, રે. સર્વ નં.૧૫૮/પૈકી નં.૧૪, આશિવાંદ કવેટ્સ, શંકર પાર્ટી પ્લોટની પાસે, નવ ગણદેવી રોડ, નવસારી, સુરત, ગુજરાત-૭૯૬૪૪૫, ભારત આવેલ મિલકતના બધા ભાગો સહિત			
શ્રી. ઘનશ્યામ વલ્લભભાઇ મર, શ્રીમતી. અસ્મિતાબેન જી.	09-05-2022 & Rs.79,22,627/-	પ્લોટ નં. ૪૨, આશરે ૮૬.૦૯ સ્કે.મી. સર્વે નં.૩૬, પૈકી: પાર્ક નામે જાણીતું, (ટી.પી.એસ. નં.૩, એક.પી. નં.૭ નાના માવા સર્કલની પાસે. નાના માવા રોડ. રાજકોટ. ગજ			

પાંભર, મેસર્સ ધનંજય ડેવલોપર્સ (રૂપિયા અગણ્યા એંસી વલ્લભભાઈ લાલજીભાઈ પાંભર નાખ બાવીસ હજાર છસો સત્યાવીસ ફક્ત) (Prospect No.733427)

સુધીમાં આઇઇપીએફમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

તારીખ : ૧૧મી મે. ૨૦૨૨

નં. ૩૦૨, આકારે બિલ્ટઅપ એરીયા ૭૫. ૧૮ કકે. મી. અને બિલ્ટઅપ એરીયા ૧૨૫.૪૬ કકે. મી. વિંગ એ, ત્રીજો માળ, નં. ૧૧૪, સી. એસ. નં. ૪૭૧૮, રે. સર્વે નં. ૧૫૮ /પૈકી, વોર્ડ ૪, આરિવાર્ડ કર્વસ્ત્ર, શંકર પાર્ટી પ્લોટની પાસે, નવસારી ાવી રોડ, નવસારી, સુરત, ગુજરાત-૩૯૬ ૪૪૫, ભારત ખાતે લ મિલકતના બધા ભાગો સહિત પ્લોટ નં.૪૨, આશરે ૮૬.૦૯ સ્કે.મી. સર્વે નં.૩૬, પૈકી સાંકેત પાર્ક નામે જાણીતું, (ટી.પી.એસ. નં.૩, એફ.પી. નં.૭ પૈકી) નાના માવા સંકલની પાસે, નાના માવા રોડ, રાજકોટ, ગુજરાત-૩૬૦૦૦૨ ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત

જો આ દેવાદાર ઉપરોક્ત IFL, IFLને ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો IFL, IFL આ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ કંપરોક્ત સિક્યોર્ડ એસેટ્સ સામે કાર્યવાહી હાથ ધરશે અને લાગુ થતા નિયમો/સમગ્રપક્ષે તે દેવાદારના જોખમે અને ભોગે હેશે. વધુ માહિતી માટે અધિકૃત અધિકારીશીની: **ભાગ ઓકીસ** : IFL, IFL ઓફીસ નં. ૭૦૧, સાતમો માળ, 21^ન તેન્યુર્ચ બિઝનેસ તેન્ટ, ઉધાર વાત્રજા પાસે, રીગ દેડો, સુરત-૩૯૫૦૦૨ (અથવા ક્રોપોરેટ **ઓફિસ** : આઇઓઇએકએસ શવર પ્લોટ નં.૯૮, ઉદ્યોગ વિહાર, કેસ-૪, ગુરુગાંવ, હરીયાણા સંપર્ક કરવો.

સહી/- અધિકૃત અધિકારી, IIFL હોમ ફાઇનાન્સ લીમીટેડ વ

🌌 UJJIVAN SMALL FINANCE BANK રજીસ્ટર્ડ ઓફીસ: ગ્રેપ ગાર્ડન, ત્રીજો એ કોસ, ૧૮મો મેઈન, છઠ્ઠો ઠલોક, કોરોમંગલા, બેંગલુર-૫૬૦૦૬૫ રીજીનલ ઓફીસ - પશ્ચિમ: અલમોન્ટે આઇટી પાર્ક, ક્રમ નં. ૮, ७મો માળ, હેડપસર મુંડવા બાચપાસ, ખરાદી, પુણે-૪૧૧૦૧૪

AHMEDABAD MUNICIPAL CORPORATION

North West Zone-Engineering, Department

Tender Notice No.5/2022-23

For Works of Road, drainage, Building & Water

Online Tender Opening Date :- 10/06/2022 Time 12:00 pm

Details and Tenders Available On www.nprocure.com

ક્લજા નોટીસ (સ્થાવર મિલકત માટે) (નિયમ ૮(૧)) જ્યારે, નીચે સહી કરનાર, **ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિ**.ના અધિકૃત અધિકારી હોવાને કારણે, નાણાકીય અસ્કયામતોનું સિક્ચોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને નિયમ રાસાથે વાંચતા સિક્ચોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨, નીચે દર્શાવેલ તારીખો પર ડિમાન્ડ નોટિસ જારી કરી હતી. જેમાં ૠણ લેનારાઓ/ગીરે મુક્કનારને નીચે દર્શાવેલ રકમ આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચૂક્વર્ણ

રુજા લેનાર રકમની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યો હોય, આથી ઋણ લેનાર અને સામાન્ય રીતે જનતાને નોટિસ આપવામાં આવે છે કે **નીચે હસ્તાક્ષરકર્તાએ** અધિનિયમ ૨૦૦૨ની કલમ ૧૩(૪)ના નિયમ ૮ સાથે વાંચતા તેમને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને અહીં **નીચે વદવિલ મિલકતનો ક્બજો કહી મે, ૨૦૨૨**ના રોજ મેળવ્યો છે.

ખાસ કરીને ઋણ લેનારાઓને અને સામાન્ય રીતે લોકોને મિલકતો સાથે વ્યવહાર ન કરવા માટે સાવધાન કરવામાં આવે છે અને મિલકતો સાથેનો કોઈપણ વ્યવહાર **ઉજ્ઝવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ**ન ચાર્જને આધીન રહેશે જે અહીં નીચે દર્શાવેલ રકમ અને તેના પરના વ્યાજને પાત્ર છે. સુરક્ષિત સંપત્તિ મેળવવા માટે, ઉપલબ્ધ સમયના સંદર્ભમાં. કાયદાની કલમ ૧૩ ની પેટા

કલમ (૮) ની જોગવાઈઓ તરફ ઉધાર લેનારા અને સહ-ઉધાર લેનારાનું ધ્યાન આમંત્રિ ક્રમ.નં.૧ઃ ૠણ લેનારા/ગીરો મુકનારનું નામઃ ૧. શ્રી લાખાજી કરનાજી ઠાકોર અને સહ-ૠણ

લેનારાઃ ૨. શ્રી. વનરાજી લાખાજી ઠાકોર, ૩. શ્રીમતી. મંજીબેન લાખાજી ઠાકોર બધા રહે : ધર નં.૨૭૭, ઠાકોર નિવાસ, મુલસન, જી-સુરત, રાજ્ય-ગુજરાત-૩૮૨૭૩૦, રાજ્ય-ગુજરાત, **ડિમા**ન્ડ **નોટિસ તારીખઃ ૧૪.૧૦.૨૦૨૧ બાર્કી ૨કમઃ રૂ. ૫,૮૨,૧૩**૬/- (રૂપિયા પાંચ લાખ બ્યાંસી હજાર એક્સો છત્રીસ માત્ર) ૧૪.૧૦.૨૦૨૧ ના સુધી અને તેના પર વધુ વ્યાજ અને શુલ્ક.

સ્થાવર મિલકતનું વર્ણન : મુલસન ગ્રામ પંચાયત મિલકત નં.પ/૧૩૦ એસેસમેન્ટ સીરીયલ નં.૧૭૦, આશરે ૧૦૫૦ સ્કે.મી (ગામથળ) ઠાકોર વાસ તા- અને જીલ્લો - મહેસાણાના ભાગો સહિત જેની ચતુર્સીમા નીચે મુજબ છે. પૂર્વ - ગંધાજી ઠાકોરનું ઘર, પશ્ચિમ - જયંતીજી ગફુરજી ઠાકોરનું ઘર, ઉત્તર - જુંગાજી ઠાકોરનું ઘર, દક્ષિણ : ખુલ્લી જમીન

ક્રમ.**નં.૨ઃ ૠણ લેનારા/ગીરો મુક્તારનું નામઃ શ્રી. સંજય નાથાજી ઠાકોર,** રહે. ૫૮ ઠાકોરવાસ, ધાનપુરા જોમાંગ. આંબલીયાસન, મહેસાંણા, ગુજરાત-૩૮૨૭૩૨ **અને સહ-ૠણ લેનારાઃ શ્રી. નાથાજી રણછોડજી ઠાકોર,** રહે. ઠાકોરવાસ, ધાનપુરા જોમાંગ. આંબલીયાસન,, મહેસાણા, ગુજરાત ૩૮૨૭૩૨ શ્રીમતી. ચંદાબેન નાથાજી ઠાકોર, રહે : ૫૮ ઠાકોરવાસ, ધાનપુરા જોમાંગ આંબલીયાસન,, મહેસાણા, ગુજરાત-૩૮૨૭૩૨ કિમાન્ડ નોટિસ તારીખઃ ૩૦.૦૯.૨૦૨૧ બાકી **૨કમઃ રૂ.૪,૪૪,૪७૧/-** (રૂપિયા ચાર લાખ ચુમ્માલીસ હજાર ચારસો ઇક્કોતેર માત્ર) ૨૨.૦૯.૨૦૨૧ ના સુધી અને તેના પર વધુ વ્યાજ અને શુલ્ક.

સ્થાવર મિલકતનું વર્ણન : રેસીડેન્સીયલ બિયરીંગ ધાનપુરા ગ્રામ પંચાયત મિલકત નં.૧૩૬, એસેસમેન્ટ સિરીયલ નં.૧૭૪, ઠાકોર વાસ (ગામથળ) આશરે ૭૫૦ સ્કે.ફીટ. જીલ્લો મહેસાણા જેના તમામ ભાગો સહિત જેની ચતુર્સીમા નીચે મુજબ છે. પૂર્વ છનાજી સોમાજીની મિલ્કત, દક્ષિણ ઃ દિનેશજી મનાજીની મિલ્કત, પશ્ચિમ - માતાજીનો ચોક, ઉત્તર ઃ રોડ

ક્રમ.નં.૩ઃ ૠણ લેનારા/ગીરો મુકનારનું નામઃ ૧. લાલજીભાઇ કેશાભાઇ પટેલ, ૨) શ્રીમતી. **રાઇબેન લાલજીભાઇ પટેલ, બંજો રહે**ં કિશન સોસાયટી, રામજી મંદિરની સામે દિવાનપુરા, મીઠા, મહેસાણા, ગુજરાત-૩૮૪૦૦૧, ડિમાન્ડ નોટિસ તારીખઃ ૧૧.૧૦.૨૦૨૧ બાકી રકમઃ રૂ.૩,૦૩,૦૬૧/- (રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર એકસઠમાત્ર) ૨૭.૦૯.૨૦૨૧ ના સુધી અને તેના

સ્થાવર મિલકતનું વર્ણન : દિવાનપુરા, ગ્રામ પંચાયત મિલકત નં.૨/૧૩૨, એસેસમેન્ટ સિરીયલ નં. પર પ સ્કે.ફી. રજીસ્ટ્રેશન જીલ્લો અને સબ જિલ્લો મહેસાણાના તમામ ભાગો સહિત જેની ચતુર્સીમા નીચે મુજબ છે. : પૂર્વ : રસીકભાઇ કેશવલાલ પટેલની મિલ્કત, દક્ષિણ : બબલદાસ અંબારામદાસ પટેલની મિલકત, પશ્ચિમ : ગોઠીવાસનો રોડ, ઉત્તર : ઉમેદભાઇ મોહનભાઇ પટેલની મિલકત

અધિકૃત ઓફીસર ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક લી.

બ્લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

CIN : L17100DN1985PLC005561 રજી ઓફિસ : પ્લોટ નં.૬૩-બી, દાનુયુગ સંસ્કારી સંઘ લી. ગામ પીપરીયા, સીલવાસા, દાદરા અને નગર હવેલી-૩૯૬૨૩૦, છમેઘલ આઇડી : bluechiptex@gmail.com, વેબસાઇટ : www.bluechiptexindustrieslimited.com

ફોન નં. +૯૧ રર ૪૩૫૩ ૦૪૦૦

નોટીસ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઇઇપીએફ) ઓથોરિટીના ડિમેટ ખાતામાં ઇક્વિટી શેર્સનું ટ્રાન્સફર.

કંપનીના અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૨૪(૬)ની જોગવાઈઓને અનુલક્ષીને અહીં સૂચના આપવામાં આવી છે, જેણે સમય-સમય પર સુધારેલા રોકાલકારો શિક્ષણ અને સુરક્ષા બંડોળ સત્તાષિકાર (હિસાબી ટ્રાન્સફર અને રિફ્ક) નિયમો, ૨૦૧૬ સાથે વાંચવામાં આવે છે. બ્લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કંપની) ના શેરધારકો દ્વારા સાતના છેલ્લા સમયગાળા માટે, નિયમો), કંપનીના ઇક્વિટી શેર્સને ધ્યાનમાં રાખીને જે ડિવિડન્ડ (ઓ) ને છૂટા કરવામાં આવ્યા નથી અથવા દાવો કર્યો નથી. વર્ષ કે તેથી વધુ, કંપની દ્વારા કાયદાકીય રૂપે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત આઇ.પી.એફ. ઓથોરિટીના ડીમેટ ખાતામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, નાણાકીય વર્ષ ૨૦૧૪ ૧પના નાણાકીય વર્ષના છેલ્લા ડિવિડન્ડથી શરૂ થતા છેલ્લા સાત વર્ષ માટે દાવેદારી વિનાના / ચૂકવાયા ન હોય તેવા ડિવિડન્ડ કેટલાક શેરધારકોના નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ સુધી, હાલમાં કંપની પાસે છે. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫ માટે ક્લેમ ન કરાયુ હોય / ચૂકવાયુ ન હોય તેવું છેલ્લું ડિવિડન્ડ ને ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨

તે મુજબ અને નિયમોમાં નિયારિત વિવિધ આવશ્યકતાઓને અનુસરીને, સંબંધિત શેરહોલ્ડરોને વ્યક્તિગત સંદેશાવ્યવહાર તેમના તાજેતરના ઉપલબ્ધ સરનામાં પર મોકલવામાં આવી રહ્યા છે, જેમના શેર યોગ્ય કાર્યવાહી કરવા માટે ઉપરોક્ત નિયમો અનુસાર આઇઇપીએફ ઓથોરિટીના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવા જરૂરી છે. (ઓ) જો કંપનીને ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમાં સંબંધિત શેરધારકો દ્વારા કોઈ સંદેશાવ્યવહાર ન કરવામાં આવે તો, કંપની, નિયમોમાં નિર્ધારિત આવશ્યકતાઓનું પાલન કરવાના હેતુથી, શેરને આઇઇપીએફ ઓથોરિટીના ડીમેટ ખાતામાં બાકી દ્વારા સ્થાનાંતરિત કરશે. નિયમોમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ તારીખ. આ ઉપરાંત, કંપનીએ આવા શેરહોલ્ડરોની સંપૂર્ણ વિગતો સાથે, તેમના શેરની વિગતો સાથે, જેની વેબસાઇટ આઇબીપીએફ ઓથોરિટીના ડીમેટ ખાતામાં સ્થાનાંતરિત થવાની બાકી છે, તેની વેબસાઇટ www.bluechiptexindustrieslimited.com પર અપલોડ કરી છે. આઇઇપીએફ ઓથોરિટીના ડીમેટ ખાતામાં ટાન્સફર કરવા માટે જવાબદાર છે તેવા શેરહોલ્ડરોને તેમના અન-કેશ્ડ કરેલા ડિવિડન્ડ (ઓ) ની વિગતોની ચકાસણી માટે કંપનીની ઉપરોક્ત વેબસાઇટનો સંદર્ભ લેવા વિનંતી છે.

સંબંધિત શેરહોલ્ડરો, કીઝીકલ સ્વ3પમાં શેર ધરાવે છે અને જેમના શેરો આઇઇપીએક અધિકારીઓને ટાન્સકર કરવા માટે જવાબદાર છે, તેઓ નોંધ લે કે, કંપની તેમના દ્વારા રાખવામાં આવેલા મૂળ શેર પ્રમાણપત્ર (ઓ) ને બદલે નવું શેર પ્રમાણપત્ર (ઓ) જારી કરશે. નિયમો મુજબ આઇઇપીએફ અધિકારીઓને શેરના સ્થાનાંતરણના હેતુ અને આવા મુદ્દા પર, મૂળ શેર પ્રમાણપત્ર (ઓ) કે જેઓ તેમના નામે નોંધાયેલા છે તે આપમેળે રદ થઈ જશે અને ભિન-વાટાઘાટવાળા માનવામાં આવશે. શેરધારકોએ નોંધે કે કંપની દ્વારા તેની વેબસાઇટ પર અપલોડ કરેલી વિગતો નિયમોને અનુસરીને આઇપીએફ અધિકારીઓ પાસે શેરના સ્થાનાંતરણના હેતુથી કંપની દ્વારા નવા શેર પ્રમાણપત્ર (ઇસ્યુ) આપવાની બાબતમાં યોગ્ય સૂચના માનવામાં આવશે.

આવા શેર્સ પરનો આગળના કોઈ ડિવિડન્ડ આઇઇપીએકને જમા કરવામાં આવશે અને દાવેદારી વિનાના અવેતન ડિવિડન્ડ અને / અથવા આઇઇપીએફને ટ્રાન્સફર કરેલા શેરના સંદર્ભમાં કોઈ દાવો કંપની સામે કરી શકશે નહીં. ડિવિડન્ડ અને શેરો આઇઇપીએફને ટ્રાન્સફર કરવા પર, શેરહોલ્ડરો નિયમોમાં સૂચવેલ પ્રક્રિયા મુજબ ફોર્મ આઇઇપીએફ - પ માં આઇઇપીએફ ને એરજી કરીને તે જ દાવો કરી શકે છે. આ ફોર્મ આઇઇપીએફ એટલે કે વેબસાઇટ www.iepf.gov.in. પર ઉપલબ્ધ છે.

જો શેરહોલ્ડરોને વિષય અને નિયમો અંગે કોઈ પ્રશ્નો હોય તો, તેઓ કંપનીના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) અથવા કંપનીને નીચે જણાવેલ સરનામાં પર સંપર્ક કરી શકે છે.

ા. બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ (આરટીએ), પહેલો માળ, ભારત ટીન વર્ક્સ બિલ્ડિંગ, સામે. વસંત ઓએસિસ, મકવાણા રોડ, મરોલ, અધેરી ઇસ્ટ, મુંબઇ - ૪૦૦ ૦૫૯, ઇમેઇલઃ investor@bigshareonline.com, ટેલિનંબરઃ ૯૧૨૨ દરદ૩૮૨૦૦, ફેક્સનંબરઃ ૯૧૨૨

૨. ૦લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઓફીસ નંબર ૧૫-૧૭, પહેલો માળ, મેકર ચેમ્બર્સ III, જમનાલાલ મુજાજ રોડ, નરીમન પોઇન્ટે, મુંબઇ - ૪૦૦ ૦૨૧, ઇમેઇલ આઈડી: bluechiptex @gmail.com, ટેલિ. નંબર ૯૧ ૨૨ ૪૩૫૩ ૦૪૦૦

> બોર્ડ ઓક્ ડિરેક્ટર્સના આદેશ અનસાર **૦લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ** સહી/- **ભૂમિત.એમ. ધરોડ** કંપની સચિવ અને પાલન અધિકારી

HT



E-Tender No:08/2022-23 "Supply of Laboratory Chemicals, Glassware's and Miscellaneous Articles to the Central Laboratory of Ahmedabad Municipal Corporation"

DETAILS AND TENDER AVAILABLE OF	https://amc.nprocure.com
TECHNICAL BID OPENING	04/06/2022, UP TO 5.00 PM
TECHNICAL BID PHYSICAL SUBMISS	ION 04/06/2022 UP TO 4:00 PM
ONLINE TENDER SUBMISSION	03/06/2022, UP TO 6:00 PM